

વેચાણ દસ્તાવેજ

આજ રોજ તારીખ : _____ ને _____ વારના
રોજ " એપલ હેરીટેજ " નામની યોજનામાં _____ વીંગમાં _____
ફ્લોર ઉપર આવેલ ફ્લેટ/દુકાન/ઓફીસ નંબર : _____ નો રૂા.
_____/— માં વેચાણ દસ્તાવેજ.....

લખી લેનાર / વેચાણ રાખનાર / પ્રથમ પક્ષવાળા :

- (૧) _____,
ઉ.વ.આ._____, ધંધો : _____, (PAN : _____)
- (૨) _____,
ઉ.વ.આ._____, ધંધો : _____, (PAN : _____)
રહેવાસી : _____

(જેમને હવે પછી સદર વેચાણ દસ્તાવેજમાં "પ્રથમ પક્ષવાળા" અથવા "વેચાણ રાખનાર" અથવા "એલોટી" અથવા "તમો" તે રીતે સંબોધવામાં આવેલ છે. જે શબ્દના અર્થમાં પ્રથમ પક્ષવાળા અને / તથા તેઓના વંશ, વાલી, વારસો, સક્સેસરો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમીનીસ્ટ્રેટરો, ઈત્યાદી તમામનો સમાવેશ થાય છે.)

લખી આપનાર / જમીન માલીક / બીજા પક્ષવાળા :

મે. શ્રી ડેવલોપર્સ ના નામની ભાગીદારી પેઢીના ભાગીદારો પાન
નંબર—AEGFS3052J

- (૧) રસિકલાલ ત્રીકમભાઈ જાવીયા, ઉ.વ. આ. ૫૫.
(૨) કીશન ચંદુલાલ જાવિયા, ઉ.વ. આ. ૨૫
(૩) કમલેશ લીલાધરભાઈ વાઘેલા, ઉ.વ. આ. ૫૧
(૪) નગીન લીલાધર વાઘેલા, ઉ.વ. આ. ૪૫
(૫) કમલેશકુમાર કાંતીલાલ રાવલ, ઉ.વ. આ. ૫૪
(૬) ચેનીશા હરસુખભાઈ કુંભાણી, ઉ.વ. આ. ૨૪
(૭) હેમાંગ પ્રવિણભાઈ વાઘેલા, ઉ.વ. આ. ૨૯,
તમામ ધર્મ—હિન્દુ, ધંધો : વેપાર, રહે. એપલવુડ ટાઉનશીપ,
ટીંબાવાડી, જુનાગઢ.

(જેમને હવે પછી સદર વેચાણ દસ્તાવેજમાં "બીજા પક્ષકાર" અથવા "વેચાણ આપનાર" અથવા "પ્રયોજક" અથવા "પ્રમોટર" અથવા "અમો" તે રીતે

સંબોધવામાં આવેલ છે. જે શબ્દના અર્થમાં બીજા પક્ષવાળી ભાગીદારી પેઢીના હાલના તથા વખતોવખતના હયાત ભાગીદાર તથા નવા જોડાયેલ ભાગીદારો અને / તથા તેઓના વંશ, વાલી, વારસો, સકસેસરો, એસાઈનીઓ, એક્ઝીક્યુટો, એડમીનીસ્ટ્રેટરો, ઈત્યાદી તમામનો સમાવેશ થાય છે.)

સદર વેચાણ દસ્તાવેજ અમો / બીજા પક્ષવાળા મળી તમો / પ્રથમ પક્ષવાળાને અમો તમામની રાજીખુશીથી લખી આપીએ છીએ કે.....

મિલકતના ટાઈટલની વિગત:-

(૧) રેવન્યુ સર્વે નં. ૧૫૪/પૈકી ૧ તથા રેવન્યુ સર્વે નં. ૧૫૪/પૈકી ૧/પૈકી ૧ વાળી જમીનના ટાઈટલની વિગત :-

(એ) સદરહુ જુનાગઢ શહેરમાં મહાનગરપાલીકાની હદમાં આવેલ ગામ મોજે ટીંબાવાડી ગામના રેવન્યુ સર્વે નં. ૧૫૪ તથા અન્ય સર્વે નંબરની જમીન ભીમા ખીમા વિગેરેના કબ્જા ભોગવટાની આવેલ હોય અને હેયાત હોય, કબ્જો તેઓની પાસેજ હોય સદરહુ જમીન અંગેનું ખેડખાતુ તેઓના નામે ચાલુ રાખવામાં આવેલ અને તે અંગેની પ્રમોલગેશન નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં. ૩૦ થી થયેલ છે.

(બી) ત્યારબાદ સદરહુ રેવન્યુ સર્વે નં. ૧૫૪ તથા અન્ય સર્વે નંબરની જમીનના ઉપરોક્ત માલીક ભીમા ખીમાનું તા.૯/૨/૧૯૬૨ ના રોજ અવસાન થતા તેના સીધીલીટીના વારસદારો તરીકે (૧) વાલજી ભીમા, (૨) જેઠી ભીમા, (૩) મણી ભીમા, (૪) જેથી ભીમા આવેલ હતા પરંતુ ગુજરનારની પુત્રીઓએ તેમના પીતાના ખાતામાંથી રાજીખુશીથી ભાગ ઉઠાવી લેવા કબુલાત આપતા સદરહુ સર્વે નં. ૧૫૪ તથા અન્ય સર્વે નંબરોની જમીન શ્રી વાલજી ભીમાના એકલાના નામે કરવામાં આવેલ હતી અને તે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં. ૨૨૨, તા.૨૩/૨/૧૯૬૨ ના રોજથી થયેલ છે.

(સી) ત્યારબાદ સદરહુ સર્વે નં. ૧૫૪ તથા અન્ય સર્વે નંબરોની જમીનના ઉપરોક્ત માલીક શ્રી વાલજીભાઈ ભીમાભાઈએ પોતાની હેયાતીમાં સદરહુ જમીન અંગે ઘરમેળે સમજુતીથી ભાઈઓ ભાગ કરી પોતાના પુત્રોના ખાતે કરવા અરજી તથા કબુલાત આપતા સદરહુ સર્વે નં. ૧૫૪ પૈકી એ. ૩-૨૮ ગુંઠા તથા સર્વે નં. ૬૫ પૈકી. એ. ૨-૩૨ ગુંઠા વાળી જમીન મળી કુલ એ. ૬-૨૦ ગુંઠા વાળી જમીન શ્રી ગોકળદાસ વાલજીના ભાગે આવેલ હતી તથા સદરહુ સર્વે નં. ૧૫૪ પૈકી એ. ૩-૨૮ ગુંઠા તથા સર્વે નં. ૬૫ પૈકી એ. ૨-૩૨ ગુંઠા વાળી જમીન મળી કુલ એ. ૬-૨૦ ગુંઠા વાળી જમીન શ્રી પરસોતમ વાલજીના ભાગે આવેલ હતી તે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં. ૭૭૪, તા. ૨/૧૨/૧૯૮૧ ના રોજથી થયેલ છે.

(ડી) ત્યારબાદ ટીંબાવાડી ગામના ખેડખાતા નં.૯૬ થી આવેલ સદરહુ સર્વે નં. ૧૫૪ પૈકી એ. ૩-૨૮ ગુંઠા વાળી જમીનના માલીક શ્રી ગોકળદાસ વાલજીભાઈ ભલાણીએ પોતાની હેયાતીમાં તેમના વારસદારોના નામ દાખલ કરવા માંગણી કરતા સદરહુ જમીન અંગે ચાલતા ખેડખાતામાં (૧) શ્રી રસીલાબેન ગોકળદાસ ભલાણી, (૨) શ્રી કિશોરભાઈ ગોકળદાસ ભલાણી, (૩) શ્રી સંજયભાઈ ગોકળદાસ ભલાણી તથા (૪) શ્રી મનીષાબેન ગોકળદાસ ભલાણીના નામો દાખલ કરવામાં આવેલ હતા અને તે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં. ૮૧૨૭, તા. ૧૮/૦૫/૨૦૦૨ ના રોજથી થયેલ છે. જે નોંધ મંજૂર થયેલ છે.

(ઈ) ત્યારબાદ ટીંબાવાડી ગામના ખેડખાતા નં. ૯૬ થી આવેલ સદરહુ સર્વે નં. ૧૫૪/પૈકી એ. ૩-૨૮ ગુંઠા ગાળી જમીનના સહમાલીકો પૈકી શ્રી ગોકળદાસ વાલજીભાઈ ભલાણીનું તા.૧૭/૦૨/૨૦૧૮ ના રોજ અવસાન થતા સદરહુ જમીન અંગે ચાલતા ખેડખાતા માંથી ગુજરનાર ગોકળદાસ વાલજીભાઈ ભલાણીનું નામ કમી કરવામાં આવેલ હતું અને તે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં. ૨૪૯૩૫, તા.૧૬/૪/૨૦૧૮ ના રોજથી થયેલ છે. જે નોંધ મંજૂર થયેલ છે. આમ સદરહુ જમીન (૧) શ્રી રસીલાબેન ગોકળદાસ ભલાણી, (૨) શ્રી કિશોરભાઈ ગોકળદાસ ભલાણી, (૩) શ્રી સંજયભાઈ ગોકળદાસ ભલાણી તથા (૪) શ્રી મનીષાબેન ગોકળદાસ ભલાણીની માલીકી કબ્જા ભોગવટાની બનેલ હતી.

(એફ) ત્યારબાદ ટીંબાવાડી ગામના ખેડખાતા નં.૯૬ થી આવેલ સદરહુ સર્વે નં. ૧૫૪/પૈકી એ. ૩-૨૮ ગુંઠાના હેક્ટર ૧-૪૯-૭૩ આરે વાળી જમીનમાંથી દક્ષિણ દિશા તરફના ભાગની જમીન હેક્ટર ૧-૦૯-૨૬ આરેની જમીન તેના ઉપરોક્ત માલીકો (૧) શ્રી રસીલાબેન ગોકળદાસ ભલાણી, (૨) શ્રી કિશોરભાઈ ગોકળદાસ ભલાણી તે જાતે તથા ક્રમ નં. ૩) શ્રી સંજયભાઈ ગોકળદાસ ભલાણીના ભલાણીના કુલમુખત્યાર દરજજે તથા (૪) શ્રી મનીષાબેન ગોકળદાસ ભલાણી પાસેથી જુનાગઢ સબ-રજીસ્ટ્રાર કચેરીના વેચાણ દસ્તાવેજ અનુ.નં. ૪૬૫૪, તા.૫/૧૧/૨૦૧૮ ના રોજથી શ્રી જયેશભાઈ પ્રભુદાસભાઈ બદાણીના નામે વેચાણ લીધેલ છે અને તે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં.૨૫૭૨૨, તા. ૩૧/૦૧/૨૦૧૯ ના રોજથી થયેલ છે.

તેમજ સદરહુ ટીંબાવાડી ગામના ખેડખાતા નં.૯૬ થી આવેલ સદરહુ સર્વે નં. ૧૫૪ પૈકી એ. ૩-૨૮ ગુંઠાના હે.આ.ચો.મી. ૧-૪૯-૭૩ વાળી જમીનમાંથી ઉતર દિશા તરફના ભાગની જમીન હે.આ.ચો.મી. ૦-૪૦-૪૭ ની જમીન તેના ઉપરોક્ત માલીકો (૧) શ્રી રસીલાબેન ગોકળદાસ ભલાણી, (૨) શ્રી કિશોરભાઈ ગોકળદાસ ભલાણી તે જાતે તથા ક્રમ નં. ૩) શ્રી સંજયભાઈ ગોકળદાસ ભલાણીના કુલમુખત્યાર દરજજે તથા (૪) શ્રી મનીષાબેન ગોકળદાસ ભલાણી પાસેથી જુનાગઢ સબ-રજીસ્ટ્રાર કચેરીના વેચાણ દસ્તાવેજ અનુ.નં. ૫૦૪૨,

તા.૬/૧૨/૧૮ ના રોજથી શ્રી જયેશભાઈ પ્રભુદાસભાઈ બદાણીના નામે વેચાણ લીધેલ છે અને તે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં. ૨૫૭૨૪, તા. ૧૩/૦૩/૨૦૧૮ ના રોજથી થયેલ છે.

(૨) રેવન્યુ સર્વે નં. ૧૫૪/પૈકી.૨ વાળી જમીનના ટાઈટલની વિગત :—

(એ) ત્યારબાદ ઉપરોક્ત વિગતે સદરહુ સર્વે નં. ૧૫૪ પૈકી એ. ૩—૨૮ ગુંઠા તથા સર્વે નં. ૬૫ પૈકી એ. ૨—૩૨ ગુંઠા વાળી જમીન મળી કુલ એ. ૬—૨૦ ગુંઠા વાળી જમીન શ્રી પરસોતમ વાલજીભાઈના ભાગે આવેલ જમીન જેનું ખેડખાતુ ખેડખાતા નં.૯૭ થી આવેલ હતું તે જમીનો પૈકી સર્વે નં. ૧૫૪ પૈકીની જમીન એ.૦—૦૩ ગુંઠા વાળી જમીન જુનાગઢ વંથલી રોડમાં કપાત થતા તે અંગે ડી.ઈ.લે.સા. જુનાગઢના હુકમ નં.ડી.ટી.આર./૨૧૮૬ થી દુરસ્તી કરી ડી.આઈ.એલ.આર. ના કે.જે.પી.દુ.પ.નં.૧૩ મુજબ નોંધ કરવામાં આવેલ હતી અને તે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં. ૧૧૨૬ થી થયેલ છે.

(બ) ત્યારબાદ ટીંબાવાડી ગામના ખેડખાતા નં.૯૭ થી આવેલ સદરહુ સર્વે નં.૧૫૪ પૈકી એ. ૩—૨૫ ગુંઠા વાળી જમીનના માલીક શ્રી પરસોતમભાઈ વાલજીભાઈ ભલાણીએ પોતાની હૈયાતીમાં તેમના વારસદારોના નામ દાખલ કરવા માંગણી કરતા સદરહુ જમીન અંગે ચાલતા ખેડખાતા (૧) શ્રી નિર્મળાબેન પરસોતમભાઈ ભલાણી, (૨) શ્રી કેતનભાઈ પરસોતમભાઈ ભલાણી, (૩) શ્રી જસ્મીનભાઈ પરસોતમભાઈ ભલાણીના નામો દાખલ કરવામાં આવેલ હતા અને તે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં. ૮૧૨૬, તા. ૧૮/૫/૨૦૦૨ ના રોજથી થયેલ છે. જે નોંધ મંજૂર થયેલ છે.

(એફ) ત્યારબાદ ટીંબાવાડી ગામના ખેડખાતા નં. ૯૬ થી આવેલ સદરહુ સર્વે નં. ૧૫૪ પૈકી એ. ૩—૧૮ ગુંઠાના હેક્ટર ૧—૪૯—૭૩ આરે વાળી જમીનમાંથી દક્ષીણ દિશા તરફના ભાગની જમીન હે. ૧—૦૯—૨૬ આરેની જમીન તેના ઉપરોક્ત માલીકો (૧) શ્રી પરસોતમભાઈ વાલજીભાઈ ભલાણી, (૨) શ્રી નિર્મળાબેન પરસોતમભાઈ ભલાણી, (૩) શ્રી કેતનભાઈ પરસોતમભાઈ ભલાણી તથા (૪) શ્રી જસ્મીનભાઈ પરસોતમભાઈ ભલાણી પાસેથી જુનાગઢ સબ—રજીસ્ટ્રાર કચેરીના વેચાણ દસ્તાવેજ અનું. નં. ૪૬૫૫, તા.૫/૧૧/૧૮ ના રોજથી શ્રી જયેશભાઈ પ્રભુદાસભાઈ બદાણીના નામે વેચાણ લીધેલ છે અને તે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં. ૨૫૭૨૫, તા. ૩૧/૦૧/૨૦૧૮ ના રોજથી થયેલ છે.

(૩) ઉપરોક્ત વિગતે ત્રણ અલગ અલગ વેચાણ દસ્તાવેજોથી ખરીદ કરેલ જુનાગઢ શહેરમાં મહાનગરપાલીકાની હદમાં આવેલ ગામ મોજે ટીંબાવાડી ગામના રે.સર્વે નં. ૧૫૪/પૈકી ૧ ની જમીન હે. આ.ચો.મી. ૦—૪૦—૪૭ તથા રે.સર્વે નં. ૧૫૪/પૈકી.૧/પૈકી ૧ ની જમીન હે. આ.ચો.મી. ૧—૦૯—૨૬ તથા રે.સર્વે નં.

૧૫૪/પૈકી.૨ ની જમીન હે. આ.યો.મી. ૧-૪૬-૬૯ વાળી જમીન મળી કુલ જમીન હે.આ.યો.મી. ૨-૯૬-૪૨ વાળી જમીન શ્રી જયેશભાઈ પ્રભુદાસભાઈ બદાણીની માલીકી કબ્જા ભોગવટાની બનેલ છે અને તેની નોંધ પણ રેવન્યુ રેકર્ડમાં થયેલ અને જેનું ખેડખાતું ખાતા નં. ૬૩૨૨ થી તલાટી દફતરે ચાલતું હતું.

(૪) ત્યારબાદ ઉપરોક્ત વિગતે આવેલ જુનાગઢ શહેરમાં મહાનગરપાલીકા હદમાં આવેલ ગામ મોજે ટીંબાવાડી ગામના રે.સર્વે નં. ૧૫૪/પૈકી.૧ ની જમીન હે.આ.યો.મી. ૦-૪૦-૪૭(યો.મી. ૪૦૪૭.૦૦) વાળી જમીન રહેણાંકના હેતુ માટે બીનખેતીમાં ફેરવવા શ્રી જયેશભાઈ પ્રભુદાસભાઈ બદાણીએ તેનો ધોરણસરનો લે-આઉટ પ્લાન તૈયાર કરાવી ઓનલાઈન અરજીથી શ્રી કલેક્ટર સાહેબ, કલેક્ટર કચેરી જુનાગઢને અરજ અહેવાલ કરતા અને તે અંગેનો ધોરણસરનો તુમાર ચાલી જતા છેવટમાં શ્રી કલેક્ટર સાહેબ જુનાગઢના બીનખેતી હુકમ નં. ૪૮/૧૨/૧૫/૦૩૩/૨૦૧૯, તા. ૨૧/૦૬/૨૦૧૯ ના રોજથી સદરહુ જમીન રહેણાંકના હેતુ માટે બીનખેતીમાં ફેરવી આપવામાં આવેલ હતી અને તે અંગેની બીનખેતીની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં.૨૫૭૨૬, તા. ૨૬/૬/૨૦૧૯ ના રોજથી થયેલ.

(૫) તેમજ રે.સર્વે નં. ૧૫૪/પૈકી.૧ /પૈકી ૧ ની જમીન હે.આ.યો.મી. ૧-૦૯-૨૬(યો.મી. ૧૦૯૨૬.૦૦) વાળી જમીન રહેણાંકના હેતુ માટે બીનખેતીમાં ફેરવવા શ્રી જયેશભાઈ પ્રભુદાસભાઈ બદાણીએ તેનો ધોરણસરનો લે-આઉટ પ્લાન તૈયાર કરાવી ઓનલાઈન અરજીથી શ્રી કલેક્ટર સાહેબ, કચેરી-જુનાગઢને અરજ અહેવાલ કરતા અને તે અંગેનો ધોરણસરનો તુમાર ચાલી જતા છેવટમાં શ્રી કલેક્ટર સાહેબ જુનાગઢના બીનખેતી હુકમ નં. ૪૮/૧૨/૧૫/૦૩૩/૨૦૧૯, તા. ૨૨/૬/૨૦૧૯ ના રોજથી સદરહુ જમીન રહેણાંકના હેતુ માટે બીનખેતીમાં ફેરવી આપવામાં આવેલ હતી અને તે અંગેની બીનખેતીની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં. ૨૫૭૨૭, તા.૨૬/૦૬/૨૦૧૯ ના રોજથી થયેલ છે.

(૬) તેમજ રે.સર્વે નં. ૧૫૪/પૈકી.૨ ની જમીન હે. આ.યો.મી. ૧-૪૬-૬૯ (યો.મી. ૧૪૬૬૯.૦૦) વાળી જમીન રહેણાંકના હેતુ માટે બીનખેતીમાં ફેરવવા શ્રી જયેશભાઈ પ્રભુદાસભાઈ બદાણીએ તેનો ધોરણસરનો લે-આઉટ પ્લાન તૈયાર કરાવી ઓનલાઈન અરજીથી શ્રી કલેક્ટર સાહેબ, કચેરી-જુનાગઢને અરજ અહેવાલ કરતા અને તે અંગેનો ધોરણસરનો તુમાર ચાલી જતા છેવટમાં શ્રી કલેક્ટર સાહેબ જુનાગઢના બીનખેતી હુકમ નં. ૫૦/૧૨/૧૫/૦૩૩/૨૦૧૯, તા. ૨૫/૬/૨૦૧૯ ના રોજથી સદરહુ જમીન રહેણાંકના હેતુ માટે બીનખેતીમાં ફેરવી આપવામાં આવેલ હતી અને તે અંગેની બીનખેતીની નોંધ રેવન્યુ રેકર્ડમાં હકક પત્રકે નોંધ નં. ૨૫૭૨૮, તા.૨૬/૦૬/૨૦૧૯ ના રોજથી થયેલ છે.

(૭) ઉપરોક્ત વિગતે બીનખેતી થયેલ ટીંબાવાડી ગામના રેવન્યુ સર્વે નં.૧૫૪/પૈકી૧ ની જમીન હે.આ.ચો.મી. ૦-૪૦-૪૭ તથા રેવન્યુ સર્વે નં.૧૫૪/પૈકી.૧/પૈકી.૧ ની જમીન હે.આ.ચો.મી. ૧-૦૯-૨૬ તથા રેવન્યુ સર્વે નં.૧૫૪/પૈકી ૨ ની જમીન હે.આ.ચો.મી. ૧-૪૬-૬૯ વાળી જમીન મળી કુલ જમીન હે. આ.ચો.મી. ૨-૯૬-૪૨ વાળી જમીન ત્રણ અલગ અલગ હુકમથી બીનખેતી થયેલ હતી અને તેઓ એકજ લે-આઉટ પ્લાન જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીના હુકમ નં. જેએમસી/પ્લાન/ટીંબાવાડી/૧૮૬૪/૯૧૨/૨૦૧૯/૨૦, તા.૨૦/૦૬/૨૦૧૯ ના રોજથી મંજૂર કરવામાં આવેલ છે અને તેના મંજૂર થયેલ લે-આઉટ પ્લાન મુજબ શ્રી જયેશભાઈ પ્રભુદાસભાઈ બદાણીએ સદરહુ જમીનમાં પ્લોટો પાડેલ છે અને તે સમગ્ર બીનખેતી થયેલ જમીન હાલ "એપલવુડ ટાઉનશીપ" ના નામે ઓળખાય છે.

(૮) આમ ઉપરોક્ત વિગતે શ્રી જયેશભાઈ પ્રભુદાસભાઈ બદાણીની માલીકીની આવેલ "એપલવુડ ટાઉનશીપ"ના નામે ઓળખાતી બીનખેતી જમીનના મંજૂર થયેલ લે-આઉટ પ્લાનમાં જણાવેલા પ્લોટો પૈકી પ્લોટ નં. ૨ ની જમીન ચો.મી. ૬૧૧.૨૧ ક્ષેત્રફળ ધરાવતી ખુલ્લી જમીન તેના માલીક શ્રી જયેશભાઈ પ્રભુદાસભાઈ બદાણી પાસેથી અમો લખી આપનાર એટલે કે મે. શ્રી ડેવલોપર્સ ના નામની ભાગીદારી પેઢીના ભાગીદારો (૧) રસિકલાલ ત્રીકમભાઈ જાવીયા, (૨) કીશન ચંદુલાલ જાવિયા, (૩) કમલેશ લીલાધરભાઈ વાઘેલા, (૪) નગીન લીલાધર વાઘેલા, (૫) કમલેશકુમાર કાંતીલાલ રાવલ, (૬) ચેનીશા હરસુખભાઈ કુંભાણી, (૭) હેમાંગ પ્રવિણભાઈ વાઘેલા-એ જુનાગઢ સબ રજીસ્ટ્રાર કચેરીના રજી.વેચાણ દસ્તાવેજ અનું. નં. ૭૨૧૪, તા. ૧/૧૦/૨૦૨૨ ના રોજ વેચાણ રાખેલ.

(૧૭) ત્યારબાદ ઉપરોક્ત માલીકો કે જે મે. શ્રી ડેવલોપર્સ ના નામની ભાગીદારી પેઢીના ભાગીદારો (૧) રસિકલાલ ત્રીકમભાઈ જાવીયા, (૨) કીશન ચંદુલાલ જાવિયા, (૩) કમલેશ લીલાધરભાઈ વાઘેલા, (૪) નગીન લીલાધર વાઘેલા, (૫) કમલેશકુમાર કાંતીલાલ રાવલ, (૬) ચેનીશા હરસુખભાઈ કુંભાણી, (૭) હેમાંગ પ્રવિણભાઈ વાઘેલા-એ સદરહુ જમીનના પ્લોટ નંબર-૨ ની જમીન ચો.મી. ૬૧૧.૨૧ ક્ષેત્રફળ ધરાવતી ખુલ્લી જમીન ઉપર બાંધકામ કરવા માટેનું આયોજન કરતા અને તે અંગેનો અરજ અહેવાલ જુનાગઢ મહાનગરપાલીકા કચેરીને કરતા તેમની કચેરીના બાંધકામ વિકાસ પરવાનગી રજાચીટ્ટી નં. 007BP22231584, તા.૨/૦૧/૨૦૨૪ થી સદરહુ પ્લોટ નં. ૧ ની જમીન ચો.મીટર ૬૧૧.૨૧ આ ના ક્ષેત્રફળ ધરાવતી ખુલ્લી જમીન ઉપર બાંધકામ કરવા અંગેની બાંધકામ મંજૂરી આપવામાં આવેલ અને તે સાથે રજુ કરાયેલ બાંધકામ પ્લાન મંજૂર કરવામાં આવેલ.

ત્યારબાદ ઉપરોક્ત માલીકો કે જે મે. શ્રી ડેવલોપર્સ ના નામની ભાગીદારી પેઢીના ભાગીદારો (૧) રસિકલાલ ત્રીકમભાઈ જાવીયા, (૨) કીશન ચંદુલાલ

જાવિયા, (૩) કમલેશ લીલાધરભાઈ વાઘેલા, (૪) નગીન લીલાધર વાઘેલા, (૫) કમલેશકુમાર કાંતીલાલ રાવલ, (૬) ચેનીશા હરસુખભાઈ કુંભાણી, (૭) હેમાંગ પ્રવિણભાઈ વાઘેલા—એ જુનાગઢ જીલ્લાના તાલુકા જુનાગઢના ગામ મોજે જુનાગઢ શહેરમાં મહાનગરપાલીકાની હદમાં આવેલ ગામ મોજે ટીંબાવાડી ગામના રેવન્યુ સર્વે નં. ૧૫૪/પૈકી.૧ ની જમીન હે.આ.ચો.મી. ૦-૪૦-૪૭ તથા રેવન્યુ સર્વે નં. ૧૫૪/પૈકી.૧/પૈકી.૧ ની જમીન હે.આ.ચો.મી. ૧-૦૯-૨૬ તથા રેવન્યુ સર્વે નં. ૧૫૪/પૈકી.૨ ની જમીન હે.આ.ચો.મી. ૧-૪૬-૬૯ વાળી જમીન મળી કુલ જમીન હે.આ.ચો.મી. ૨-૯૬-૪૨ વાળી રહેણાંકના હેતુ માટે બીનખેતી થયેલ જમીન કે જે હાલ "એપલવુડ ટાઉનશીપ" ના નામે ઓળખાય છે તે જમીનના મંજૂર થયેલ લે—આઉટ પ્લાનમાં જણાવેલા પ્લોટો પૈકી પ્લોટ નં. ૨ ની જમીન ચો.મી. ૬૧૧.૨૧ ના ક્ષેત્રફળ ધરાવતી જમીન ઉપર રહેણાક હેતુ માટે "એપલ હેરીટેજ " નામના બહુમાળી બિલ્ડીંગનું બાંધકામ કરેલ અને તેની તમામ પ્રકારની વ્યવસ્થા કરવાનો અમોને સંપૂર્ણ હકક અને અધિકાર છે.

જત સદર અમો / લખી પક્ષવાળા / લખી આપનાર જમીન માલિક ભેગા મળી તમો / લખી લેનારને નીચે પરિશિષ્ટમાં જણાવેલ મિલ્કત રૂા._____/—
અંકે રૂપીયા _____ પુરામાં વેચાણ આપીએ છીએ. જે અવેજની રકમ નીચેની વિગતેથી મળી ગયેલ છે. તેના બદલામાં સદર વેચાણ દસ્તાવેજ લખી આપવામાં આવે છે.

અવેજની વિગત :-

- /૧/ રૂા._____/— તારીખ _____ ના રોજ
(અંકે રૂપીયા _____ પુરા)
- /૨/ રૂા._____/— તારીખ _____ ના રોજ
(અંકે રૂપીયા _____ પુરા)
- /૩/ રૂા._____/— તારીખ _____ ના રોજ
(અંકે રૂપીયા _____ પુરા)

ઉપરોક્ત અવેજની વિગતમાં જણાવેલ ચેક બેંકમાં પાસ થયેથી તેના બદલામાં પરિશિષ્ટમાં જણાવેલ મિલ્કત તમોને વેચાણ આપેલ છે અને તેનો પ્રત્યક્ષ કબજો અમો / લખી આપનારે, તમો / લખી લેનારને બાંધકામ પુર્ણ થયેથી આપવાનો રહેશે અને તમો લખી લેનારે તે સમયે સદર પરિશિષ્ટમાં જણાવેલ મિલ્કતનો રૂબરૂ અને પ્રત્યક્ષ કબજો માલિકી હકકે સંભાળવાનો રહેશે.

- (૧) સદર જમીન મિલ્કત ઉપર કોઈપણ વ્યક્તિ, બેંક, શ્રોફ યા નાણાંકીય સંસ્થાનો ચાર્જ, ગીરો, બોજો કે લીયન કે સુખાધીકાર અગર તો

કોઈપણ પ્રકારનો કોઈપણ હકક કે અધિકાર અમો / લખી આપનારે ઉભો કરેલ નથી. તેમજ સદર જમીન મિલ્કત અમોએ અન્ય કોઈને જામીનગીરીમાં લખી આપેલ નથી કે તેના ઉપર કોર્ટનો મનાઈ હુકમ કે એટેચમેન્ટ નથી. સદર જમીન મિલ્કત અંગે અમોએ કોઈપણ પ્રકારના વેચાણ કે ટ્રાન્સફર કરવા અંગેનો કરાર, બનાખતથી કે ભેટ કરારથી કે લેખીત યા મૌખિક અન્ય કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે વ્યક્તિના સમુહની તરફેણમાં કરી આપેલ નથી. અમો/લખી આપનારે તમોને વેચાણ આપેલ મિલ્કતના ટાઈટલ કિલયર અને માર્કેટેબલ છે તેવો પાકો ભરોસો અને વિશ્વાસ આપીએ છીએ. તેમ છતાં સદર જમીન મિલ્કતના ટાઈટલ અંગે કોઈપણ જાતનો વાંધો અગર તકરાર યા અડચણ ઉભી થાય તો તે તમામ હકકો અમો/લખી આપનાર તમોને અમારા ખર્ચે દુર કરાવી આપીશું. જો તે તમામરે દુર કરવા યા કરાવવાનો પ્રસંગ આવે તો તે અંગેનો તમામ ખર્ચ અમો / લખી આપનાર તમોને તાત્કાલીક કોઈપણ પ્રકારની તકરાર સિવાય ચુકવી આપવા માટે બંધાયેલા છીએ તેની બાંહેધરી અને વિશ્વાસ આપવામાં આવે છે.

(૨) સદર જમીન મિલ્કત અંગેના આજદીન સુધીના તમામ સરકારી તેમજ અર્ધ-સરકારી વેરા, લોકલ ઓથોરીટીના ટેક્સ તથા રેવન્યુ ટેક્સ અમોએ ભરેલા છે અને સદર વેચાણ દસ્તાવેજ થયા બાદના તમામ વેરા તથા ટેક્સ તમો/વેચાણ લેનારે ભરવાના રહેશે. પરંતુ સદર વેચાણ દસ્તાવેજ થયા બાદ ભવિષ્યમાં દસ્તાવેજ તારીખ પહેલાનો જો કોઈ વેરા અથવા ટેક્સ બાકી નીકળી આવશે તો તે તમામ રકમ અમો / લખી આપનારે ભરવાની રહેશે તેવી બાંહેધરી અને વિશ્વાસ આપવામાં આવે છે. સદર વેચાણ દસ્તાવેજની સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી, લખાઈ ફી લાગુ પડતા સરકારી અને અર્ધસરકારી ટેક્સો, લોકલ ઓથોરીટીના ટેક્સ વિગેરે જેવો તમામ ખર્ચ/લખી લેનારે ભોગવવાનો છે અને ભવિષ્યની જે કાંઈ વધારાની સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરવાની આવે તો તે તમામ રકમ ભરવાની જવાબદારી તમો/વેચાણ લેનારની છે.

(૩) સદર નીચે પરિશિષ્ટમાં જણાવેલ વેચાણ આપેલ મિલ્કત તમો / વેચાણ રાખનારને નળ, ડ્રેનેજ, લાઈટ, ટોઈલેટ, બાથરૂમ, કોમન લીફ્ટ વિગેરે તમામ સુવિધાઓને લગતાં તમામ પ્રકારના હકકો સહ, હવા ઉજાસ તથા સુખાધીકારના હકકો સાથેની તથા તેને લાગતા વળગતા એપાર્ટમેન્ટ/કોમ્પ્લેક્સ આંતરીક તથા સહીયારા રસ્તાના તથા પાણી નિકાલના સર્વે પ્રકારના હકકો સાથેની મિલ્કતના તમામ પ્રકારના કોમન હકકો સાથેની તથા "એપલ હેરીટેજ" ના સભાસદ તરીકેના તમામ હકકો યાવત ચંદ્ર દિવાકરો, કુલ અભરામ દાવે સુરજ ચંદ્ર તપે ત્યાં સુધીના હકકો તથા અધિકાર સાથે આજરોજ વેચાણ આપવામાં આવેલ છે. સદર પરિશિષ્ટમાં જણાવેલ મિલ્કતના તમો / પ્રથમ પક્ષવાળા આજથી માલિક

થયા છો અને આ મિલકતનો માલીકી હકક કોમ્પલેક્ષના નિયમોને આધિન રહીને તમારે ઉપયોગ અને ઉપયોગ કરવા તથા કરાવવાનો છે. સદર પરિશિષ્ટમાં જણાવેલ મિલકત ઉપર તમો આજથી સંપૂર્ણ હકક ધરાવો છો અને તેમાં અમો તથા અમારા વંશ, વાલી, વારસદારોનો કોઈપણ જાતનો લાગ, ભાગ, હકક, હિસ્સાનો સંબંધ રહેતો નથી.

(૪) સદર "એપલ હેરીટેજ" નામની યોજના પૈકી નીચે પરિશિષ્ટમાં જણાવેલ મિલકત સદર વેચાણ દસ્તાવેજથી તમોને વેચાણ આપેલ છે. તેથી કોમ્પલેક્ષના બેઝમેન્ટ/ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ કોમન પાર્કિંગની જગ્યા તમામ સભાસદો / મેમ્બરોએ કોઈને આવવા-જવામાં અડચણ રૂપ ન થાય તે રીતે પાર્કિંગ કરવું-કરાવવાનું છે. તમામ સભાસદોએ અનુકુળતા મુજબ પાર્કિંગ માટે મળેલ જગ્યામાં જ પાર્કિંગ કરવું-કરાવવાનું છે અને તમામ સભાસદોએ / મેમ્બરોએ પાર્કિંગની જગ્યામાં કોઈપણ જાતનું પાર્કિંગ અર્થ અથવા અન્ય કોઈપણ અર્થે બાંધકામ કરવું-કરાવવાનું નથી.

(૫) અમો / લખી આપનારે તમો / લખી લેનારને વેચાણ આપેલ મિલકતના તમો સ્વતંત્ર માલિક છો અને સદર વેચાણ દસ્તાવેજના આધારે સદરહું મિલકત સીટી સર્વે કચેરી, મહાનગર સેવાસદન કચેરી, પશ્ચિમ ગુજરાત વિજ કંપની લી., રેવન્યુ દફતરે તથા સરકારી તેમજ અર્ધ-સરકારી તથા અન્ય સંસ્થા વિગેરેમાં તમો/વેચાણ રાખનારના નામે કરાવી શકશો. આ માટે અમો / લખી આપનારની જ્યાં જ્યાં અમને જ્યારે જ્યારે સહી-સમંતીની જરૂર પડે ત્યાં અને ત્યારે તે તમામ તમો / લખી લેનારને કરી આપવા માટે કાયદેસર બંધાયેલા છીએ.

(૬) સદર વેચાણ આપેલ મિલકત "એપલ હેરીટેજ" નામની યોજનામાં આવેલ છે. તેથી કોમ્પલેક્ષના તમામ સભાસદો/મેમ્બરો ભેગા મળીને જાળવણી, સાચવણી, સફાઈ, નીભાવણી, કોમન મેન્ટેનન્સ, ચાર્જીસ માટે વિકાસ મંડળ કે એશોસીએશનની રચના કરવામાં આવે તો તેમાં તમો/લખી લેનાર ફરજીયાત સભાસદ/મેમ્બર થવાનું રહેશે. તેથી સદર કોમ્પલેક્ષના તમામ સભાસદોએ જે કાંઈ સહીયારા હકક અને અધિકાર મળવા પાત્ર છે તે તમામ તમો મેળવાને હકકદાર છો અને વહીવટ ખર્ચ, કોમન સુવીધા માટે વરાડે/સરખા ભાગે આવતો ખર્ચ પણ તમારે આપવાનો રહેશે. કોમન પેસેજ તથા લીફ્ટમાં અન્ય કોઈને પણ કોઈને અડચણ રૂપ થાય તેવો માલ-સામાન મુકવાનો નથી તથા તમામ સભાસદોને સહકાર આપવાનો રહેશે તેવી સ્પષ્ટ સમજૂતી અને શરતથી સદર વેચાણ દસ્તાવેજ તમોને લખી આપવામાં આવેલ છે.

(૭) સદર નીચે પરિશિષ્ટમાં જણાવેલ કોમ્પલેક્ષની બહાર બાલ્કની, ગ્રીલ, કલર, તથા એલીવેશનમાં કોઈપણ મેમ્બર/સભાસદોએ કોઈપણ

જાતનો ફેરફાર કરવાનો નથી. સદર કોમ્પલેક્ષના સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જેવો કે બીંબ કે કોલમમાં સુધારો-વધારો કોઈપણ સંજોગોમાં હાલમાં કે ભવિષ્યમાં થઈ શકશે નહીં તેમજ સદર સમગ્ર "એપલ હેરીટેજ" નામની યોજનાના લોકલ ઓથોરીટીમાં બાંધકામ અર્થે મંજૂર કરેલ નકશામાં દર્શાવ્યા મુજબ ખુલ્લી જમીનમાં કોઈપણ પ્રકારે કોઈપણ સભાસદ/મેમ્બર હાલમાં કે ભવિષ્યમાં અંગત માલીકી માંગી શકશે નહીં. તે જમીન કાયમને માટે ખુલ્લી રાખવા વેચાણ રાખનાર તથા સમગ્ર યોજનાના અન્ય સભાસદો બંધાયેલા છે અને રહેશે.

(૮) નીચે પરિશિષ્ટમાં જણાવેલ વેચાણ આપેલ મિલકતની જે દિવાલો બાજુની મિલકત સાથે લાગીને આવેલ છે તે તથા સ્લેબની ઉપર-નીચે તમામ દિવાલો તે બંનેની સહીયારી ગણાશે અને તેનું માપ દિવાલના મધ્યબિંદુથી ગણવાનું છે.

(૯) ભવિષ્યમાં તમો/ વેચાણ રાખનાર નીચે પરિશિષ્ટમાં જણાવેલ મિલકત વેચાણ અથવા તબદીલ અથવા ગીરો કરો ત્યારે સદર વેચાણ દસ્તાવેજથી તમોને જે હકકો અને અધિકારો મળેલ છે, ફક્ત તે જ મળેલ હકકો અને અધિકારો તથા સદર વેચાણ દસ્તાવેજમાં જણાવેલ ઉપરના નીચમો તથા શરતોને તથા વખતોવખત બનાવાવમાં આવેલ નીચમોને આધિન હકકો અને અધિકારો સહ વેચાણ અથવા તબદીલ અથવા ગીરો કરી શકશો તેવી સ્પષ્ટ શરત સહ સદર વેચાણ દસ્તાવેજ લખી આપેલ છે.

(૧૦) કબજો લેવાની તારીખ કાર્યવાહી : પ્રમોટર, સક્ષમ સત્તાધિકારી પાસેથી ઓક્યુપન્સી/કમ્પલીશન સર્ટીફિકેટ મેળવ્યા બાદ અમે અલોટી દ્વારા સદર કરાર મુજબ નાણાંની ચુકવણી થયા બાદ ૩-મહિનાની અંદર એલોટીને એપાર્ટમેન્ટ/ કોમ્પલેક્ષનો કબજો સોંપશે. પ્રમોટરએ બાબતે ખાતરી આપે છે કે પ્રમોટરના પક્ષે પૂર્ણ કરવાની આવતી કોઈપણ પ્રકારની જોગવાઈ, ઔપચારિકતા કે દસ્તાવેજીકરણને લગતી બાબતોની પૂર્તતા તે કરી આપશે. પ્રમોટર ઓક્યુપન્સી સર્ટીફિકેટ/કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યાના દિન-૧૫(પંદર) ની અંદર તેના વતી એલોટીને એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષનો કબજો સોંપવાની કાર્યવાહી કરશે.

પ્રમોટર દ્વારા લેખીતમાં સદર એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષ ઉપયોગ માટે તૈયાર હોવાની નોટીસ મળ્યેથી એલોટી દિન-૩(ત્રણ)મહીનામાં મીલકતનો કબજો લેશે.

(૧૧) એલોટી દ્વારા એપાર્ટમેન્ટ/કોમ્પલેક્ષ કબજો લેવામાં ચુક થવી : ઉપરોક્ત મુદ્દા મુજબ પ્રમોટર દ્વારા લેખિત સુચના મળ્યેથી, એલોટી સદર

કરારમાં દર્શાવેલ આવશ્યક ક્ષતિપૂર્તિઓ, બાંહેધરીઓ અને દસ્તાવેજોની પૂર્તતા કર્યા બાદ કબજો લેશે અને પ્રમોટર એલોટીને એપાર્ટમેન્ટ/કોમ્પ્લેક્સનો કબજો સોંપશે. જો એલોટી મુદ્દામાં દર્શાવેલ સમયમર્યાદામાં કબજો લેવામાં નિષ્ફળ જાય કે ચુક કરે તેવા સંજોગોમાં એલોટી લાગુ પડતા મેન્ટેનન્સ ચાર્જ ચુકવવા બંધાયેલ છે.

(૧૨) સદર એપાર્ટમેન્ટ/કોમ્પ્લેક્સનો કબજો એલોટીને સોંપ્યા બાદ પાંચ વર્ષના સમયગાળાની અંદર એલોટી એપાર્ટમેન્ટ/કોમ્પ્લેક્સની અંદર અથવા તો બિલ્ડીંગ જ્યાં એપાર્ટમેન્ટ/કોમ્પ્લેક્સ સ્થિત છે તેમાં, કોઈપણ પ્રકારની માળખાકીય ક્ષતિ અથવા કામગીરી, ગુણવત્તા કે સેવાની જોગવાઈને કારણે ઉદભવેલ ક્ષતિ પ્રમોટરના ધ્યાને લાવે, તેવા સંજોગોમાં, શક્ય હોય ત્યાં પ્રમોટરે પોતાને ખર્ચે આવી ક્ષતિ સુધારી આપશે અને જો તે રીતે ક્ષતિપૂર્તિ શક્ય ન હોય તો એલોટી પ્રમોટર પાસેથી કાયદામાં સુચવે પધ્ધતિએ વળતર મેળવી શકે છે. જો કે પ્રમોટરના નિયંત્રણ બહારની હોય તેવી કોઈપણ પ્રકારની માળખાકીય ક્ષતિ અથવા કારીગરી, ગુણવત્તા કે સેવાની જોગવાઈની ક્ષતિપૂર્તિ માટે પ્રમોટર જવાબદાર રહેશે નહીં.

(૧૩) સદર કરારમાં દર્શાવેલ એપાર્ટમેન્ટ/કોમ્પ્લેક્સ કે તેના કોઈપણ ભાગને લગતી બાબતનો કાનૂની હેતુ માટે ઉપયોગ થઈ શકશે નહીં. સદર કરારની રૂએ એલોટીને વેચવામાં આવેલ એપાર્ટમેન્ટ/કોમ્પ્લેક્સ સહીતની ખુલ્લી જગ્યા, પાર્કીંગ સ્પેશ, લોબી, દાદર, ટેરેસ વગેરે પર એલોટી પોતાનો દાવો કરી શકશે નહીં જ્યાં સુધી તે સદર કરારમાં દર્શાવ્યા મુજબ હસ્તાંતરિત કરવામાં ન આવેલ હોય.

(૧૪) અલોટીસ એસોશિએશન :

પ્રયોજકે પ્રોજેક્ટનું ઓક્યુપન્સી સર્ટીફિકેટ મળ્યાને ૩-માસની અંદર અલોટીસનું એસોશિએશન બનાવી પ્રોજેક્ટના સામાન્યવિસ્તારોના પ્રમાણસરના અવિભાજ્યહિસ્સાની સોંપણી કરી તેના વપરાશ અને મેનેજમેન્ટને લગતા તમામ હકકો અલોટીસના એસોશિએશનને સોંપી દેવાના રહેશે.

(૧૫) સમાંતરતા :

આ દસ્તાવેજની કોઈપણ જોગવાઈ અધિનિયમ અથવા તે હેઠળ ઘડેલ નિયમો અને નિયમનો હેઠળ અથવા અન્ય કોઈ લાગુ પડતા કાયદાઓ હેઠળ રદ અને બિનઅસરકારક જણાઈ આવે તો દસ્તાવેજની તેવી જોગવાઈઓને દસ્તાવેજના હેતુ સાથે વ્યાજબી રીતે અસંગત થાય તેમજ અધિનિયમ અથવા તે હેઠળ ઘડેલ નિયમો અને નિયમનો અથવા લાગુ પડતા કાયદા, જે લાગુ પડતું હોય તેને અનુકુળ રહે તેટલી હદે સુધારેલ

અથવા રદ કરેલ ગણવાની રહેશે અને દસ્તાવેજની બાકીની લાગુ પડતી જોગવાઈઓ દસ્તાવેજ કરતી વખતે યોગ્ય અને અસરકારક રહેશે.

(૧૬) તકરાર નિવારણ :

પક્ષકારો વચ્ચે થયેલ કોઈપણ તકરારનો સમાધાનથી ઉકેલ લાવવાનો રહેશે. જો સમાધાન શક્ય ન હોય તો, તકરારને રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ની જોગવાઈઓ તેમજ તે હેઠળ ઘડેલ નિયમનો હેઠળ સત્તામંડળ તરફ સંદર્ભ કરવાનો રહેશે.

(૧૭) પ્રોજેક્ટને બી.યુ./કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યા બાદ પ્રમોટરનો FSI વધારની FSI કે અને અગાશીના હકકો પર કોઈપણ પ્રકારનો દાવો રહેશે નહીં. ત્યારબાદ FSI વધારની FSI અને અગાશીના હિસ્સા પર "અલોટીના એશોસિએશન" નો હકક અને દાવો રહેશે.

સદર વેચાણ દસ્તાવેજમાં બંને પક્ષકારો વચ્ચે તા._____ ના રોજ કરવામાં આવેલ રજીસ્ટર્ડ બાનાખત (રજી.નં._____)ની જોગવાઈઓ ગ્રાહ્ય રહેશે. રજીસ્ટર્ડ બાનાખતમાં કરેલી જોગવાઈઓ નીચે મુજબ છે.

પરિશિષ્ટ વેચાણ આપેલ મિલકતનું વર્ણન

ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના તાલુકા જુનાગઢના ગામ મોજે જુનાગઢ શહેરમાં મહાનગરપાલીકાની હદમાં આવેલ ગામ મોજે ટીંબાવાડી ગામના રેવન્યુ સર્વે નં. ૧૫૪/પૈકી.૧ ની જમીન હે.આ.ચો.મી. ૦-૪૦-૪૭ તથા રેવન્યુ સર્વે નં. ૧૫૪/પૈકી.૧/પૈકી.૧ ની જમીન હે.આ.ચો.મી. ૧-૦૯-૨૬ તથા રેવન્યુ સર્વે નં. ૧૫૪/પૈકી.૨ ની જમીન હે.આ.ચો.મી. ૧-૪૬-૬૯ વાળી જમીન મળી કુલ જમીન હે.આ.ચો.મી. ૨-૯૬-૪૨ વાળી રહેણાંકના હેતુ માટે બીનખેતી થયેલ જમીન કે જે હાલ "એપલવુડ ટાઉનશીપ" ના નામે ઓળખાય છે તે જમીનના મંજૂર થયેલ લે-આઉટ પ્લાનમાં જણાવેલા પ્લોટો પૈકી પ્લોટ નં. ૨ ની જમીન ચો.મી. ૬૧૧.૨૧ ના ક્ષેત્રફળ ધરાવતી જમીન તથા તેના ઉપર રહેણાંક હેતુ માટે બાંધવામાં આવેલ બહુમાળી ઈમારત જે "એપલ હેરીટેજ" ના નામથી ઓળખાય છે. જેમાં નીચે જણાવેલ મિલકત તમોને વેચાણ આપેલ છે.

વીંગ નંબર	ફ્લોર નં.	દુકાન/ઓફીસ/ ફ્લેટ નંબર	કારપેટ એરીયા (ચો.મી.)	સામાન્ય વિસ્તારનો પ્રમાણસરનો અવિભાજ્ય હિસ્સો (ચો.મી.)

ચર્ત:સીમા

પુર્વ :-

પશ્ચિમે :—

ઉત્તરે :—

દક્ષિણે :—

સદર વેચાણ દસ્તાવેજ અમો / બીજા પક્ષવાળા અમારી સ્વતંત્ર ઈચ્છા અને તમો /પ્રથમ પક્ષકારવાળાની મરજીથી આજરોજ વાંચી, વંચાવી, સમજી, વિચારી, દીલના સાવધ પણામાં, અકકલ હોંશીયારીથી, બીનકેફ અવસ્થામાં તેમજ કોઈપણ ધાક—ધમકી, રજુઆત તે ગેર સમજુતી સીવાય, સભાન અવસ્થામાં અમારી રાજીખુશીથી કરેલ છે. જે અમોને તથા અમારા વંશ, વાલી, વારસોને કબુલ મંજૂર અને બંધનકર્તા છે અને રહેશે અને તે બદલ અમો અમારી સહી નીચે સાક્ષીઓની રૂબરૂમાં કરી આપેલ છે.

સ્થળ :

તારીખ :

લખી આપનાર / જમીન માલીક / બીજા પક્ષવાળા :


મે. શ્રી ડેવલોપર્સ ના નામની ભાગીદારી પેઢીના ભાગીદારો .

- (૧) રસિકલાલ ત્રીકમભાઈ જાવીયા,
- (૨) કીશન ચંદુલાલ જાવિયા,
- (૩) કમલેશ લીલાધરભાઈ વાઘેલા,
- (૪) નગીન લીલાધર વાઘેલા,
- (૫) કમલેશકુમાર કાંતીલાલ રાવલ,
- (૬) ચેનીશ હરસુખભાઈ કુંભાણી,
- (૭) હેમાંગ પ્રવિણભાઈ વાઘેલા,

સાક્ષી :

મિલકતનો ફોટો

રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ ની કલમ-૩૨(અ) મુજબ શિડયુલ

લખી લેનાર	ફોટોગ્રાફ	અંગુઠાનું નિશાન
		
		

લખી આપનાર	અંગુઠાનું નિશાન	
----- પ્રયોજક : મે. શ્રી ડેવલોપર્સ ના નામની ભાગીદારી પેઢીના ભાગીદારો . (૧) રસિકલાલ ત્રીકમભાઈ જાવીયા, (૨) કીશન ચંદુલાલ જાવિયા, (૩) કમલેશ લીલાધરભાઈ વાઘેલા, (૪) નગીન લીલાધર વાઘેલા, (૫) કમલેશકુમાર કાંતીલાલ રાવલ, (૬) ચેનીશા હરસુખભાઈ કુંભાણી, (૭) હેમાંગ પ્રવિણભાઈ વાઘેલા,		